

રાજકોટ મહાનગરપાલિકા - આરોગ્ય શાખા - મેલેરિયા વિભાગ



સ્વચ્છ
સર્વેક્ષણ
2022

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ
ડૉ. આંબેડકરભાવન રૂમ નં. ૬, ત્રીજો માળ, બસ સ્ટેન્ડની પાસે,
દેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૨.

☎ : 0281 - 2237062

✉ : biologist_rmc@yahoo.in

👍 Like us on Facebook : /malaria.department

તા.૦૪/૩/૨૦૨૩

-: અખબાર યાદી :-

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૨૭/૦૨/૨૩ થી તા.૦૫/૦૩/૨૩) દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અપનાવવું.

ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્પત્તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

મચ્છર જન્ય રોગો	અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા (તા.૨૭/૦૨/૨૩ થી તા.૦૫/૦૩/૨૩)	તા.૦૧/૦૧/૨૦૨૩ થી વર્ષમાં કુલ નોંધાયેલ
મેલેરિયા	૦	૩
ડેન્ગ્યુ	૨	૧૧
ચિકુનગુનિયા	૦	૨

અન્ય રોગચાળાની કેસની વિગત

(તા.૨૭/૦૨/૨૩ થી તા.૦૫/૦૩/૨૩)

ક્રમ	વિગત	કેસની સંખ્યા	તા.૦૧/૦૧/૨૦૨૩ થી વર્ષમાં કુલ નોંધાયેલ
૧	શરદી - ઉધરસના કેસ	૪૩૪	૩૫૮૪
૨	સામાન્ય તાવના કેસ	૩૬	૪૦૫
૩	ઝાડા - ઉલટીના કેસ	૧૧૫	૭૬૪
૪	ટાઈફોઈડ તાવના કેસ	૦	૦
૫	કમળો તાવના કેસ	૦	૦
૬	મરડાના કેસ	૦	૦

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહેચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૭/૦૨/૨૩ થી તા.૦૫/૦૩/૨૩ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ ૮,૫૯૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૭૧૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રજીનીયલ સાયન્સ સેન્ટર (ઇશ્વરીયા પાર્ક) તથા આસપાસનો વિસ્તાર, મોચીનગર - ૪, કૈલાશધામ પાર્ક - ૨, પુનિતનગર રોડ, જાગૃતિ શ્રમજીવી સોસા., મંગલ પાંડે ટાઉનશીપ (પુષ્કરધામ રોડ), શિલ્પન ઓનેશ્રી તથા આસપાસનો વિસ્તાર, પેલેડીયમ હાઇટસ તથા આસપાસનો વિસ્તાર, કૈલાશ પાર્ક શેરી નં. ૧૧, ૧૨, જાગૃતિદિપ એપા. તથા આસપાસનો વિસ્તાર, નરસિંહનગર શેરી નં. ૧, ૨, કર્ણાવતી સ્કુલની સામે શ્રી પ્રમુખ સ્વામી પાર્ક મેઇન રોડ, રત્નમ સ્કાઇ લાઇન મોરબી રોડ પુલ પાસે, દેવ આશિષ એપા. - અયોધ્યા ચોક તથા આસપાસનો વિસ્તાર, હિંગળાજનગર આવાસ, આદિત્ય હાઇટસ તથા આસપાસનો વિસ્તાર, કોપર હાઇટસ તથા આસપાસનો વિસ્તાર, શાંતિ એવન્યુ, ગાંધીનગર - ૫, સિટી ઇલાઇટ એપા. તથા આસપાસનો વિસ્તાર, રવી રેસીડેન્સી, ઘ પેલેસ એપા. તથા આસપાસનો વિસ્તાર, ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ તથા આસપાસનો વિસ્તાર, અરિહંત એન્કલવ તથા આસપાસ વિસ્તાર, સેલેનીયમ સીટી તથા આસપાસનો વિસ્તાર, ખોડલધામ રેસીડેન્સી શેરી નં. ૨, ગાયત્રી પાર્ક, રવીકૃષ્ણ હાઇટસ ગાયત્રીધામ સોસા., અવંતીકા પાર્ક, સિંચાઇનગર, ઘૂવનગર, ચુડાસમા પ્લોટ, વિમાનગર, વિનાયક વાટીકા - ૧, શિવમ સોસા., સાંઇબાબા સોસા., ઇસ્કોન આશ્રય એપા. તથા આસપાસનો વિસ્તાર, સાંઇબાબા પાર્ક (રેલનગર) ઋષીકેશ પાર્ક (રેલનગર), ઝાંસી કી રાણી ટાઉનશીપ (રેલનગર), ખોડીયારનગર - ૧૭ (ગોર્વધન ચોક), પુનિતનગર - ૨, ભોમેશ્વર વાડી, ગેલેક્ષી ટાઉનશીપ - કલેક્ટર કચેરી સામેનો વિસ્તાર, રાધામીરા પાર્ક, ભીમરાવનગર, લશ્મીવાડી એસ.બી.આઇ. બેંક વાળી શેરી, રાધીક પાર્ક, સન ઇલાઇટ એપા. ની આસપાસનો વિસ્તાર, શિલ્પન નોવા - ગંગોત્રી મે. રોડ, આદિત્ય હાઇટસ આસપાસનો વિસ્તાર, વિમલનગર શેરી નં. ૨, વિમલનગર મે. રોડ, શારદાનગર - ૮, જીવનનગર - ૪, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં. ૨, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મે. રોડ, મેરી ગોલ્ડ એપા. (રેલનગર) આસપાસનો વિસ્તાર, મહર્ષિ દયાનંદર સરસ્વતી ટાઉનશીપ આસપાસનો વિસ્તાર, રાધા કિષ્ના પાર્ક, દેવલોક પાર્ક (રેલનગર), ઝુલેલાલ નગર, સિન્ધી કોલોની, લાલબહાદુર શાસ્ત્રીનગર, પોટપરા નાલા પાસેનો વિસ્તાર, કાશીવિશ્વનાથ - ૩, વિમાનગર, રામનાથપરા, રામનાથ મહાદેવ મંદિર પાસેનો વિસ્તાર, ભવાનીનગર, જુનુસાગર સોસા., મહેશ્વર સોસા. - ભવાની ચોક, મહેશ્વર પાર્ક - ૩ નાગબાઇ મંદિર રોડ, રાધામીરા પાર્ક વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્જ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૮૬ પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં ૨૮૭ અને કોર્મશીયલ ૨૦ આસામીને નોટીસ આપવામાં આવેલ છે.

ડેન્જ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અપનાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યક્તિઓ સુધી પહોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનીટ આપને તેમજ આપના પરિવારને ડેન્જ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

ખાસ કરીને ડેન્જ્યુ મેલેરિયા અટકાયતી માટે આટલું જરૂરી કરીએ.

- (૧) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચુસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
- (૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
- (૩) ફિજની ટ્રે, માટલા, કુલર, કુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરીએ.

- (૪) બિનજરૂરી ડબ્બાડબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
- (૫) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
- (૬) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરીએ.
- (૭) ડેબ્બુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુરૂ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.

યાદ રાખો... આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, મચ્છરમુક્ત રાજકોટ

આરોગ્ય અધિકારી
રાજકોટ મહાનગરપાલિકા